



એલીસબ્રીજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર.



પ્રેસનોટ

**સને - ૨૦૧૭ થી નાસતા ફરતા આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડી રૂ.
૧,૨૨,૯૮,૩૧૩/- (એક કરોડ બાવીસ લાખ) નો મુદ્દામાલ રિકવર કરતી
એલીસબ્રીજ પોલીસ**

મે. પોલીસ કમિશ્નર શ્રી એ.કે.સિંઘ સાહેબ તથા મે. સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબ તથા મે. નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ શ્રી કે.એન.ડામોર સાહેબ તથા મે. મદદનીશ પોલીસ કમિશ્નર એમ વિભાગ શ્રી વી.જી. પટેલ સાહેબ તથા પો.ઈન્સ. એલીસબ્રીજ પો.સ્ટે. શ્રી એ.એસ.પટેલ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. એ.પી. જેબલીયા તથા સાથેના સ્ટાફના હે.કો. રતનસિંહ હિમતસિંહ તથા હે.કો. અખિલેશકુમાર જગદીશ તથા હે.કો. મો.ફાફખાન અલીખાન તથા પો.કો. અલ્પેસભાઈ વાઘુભાઈ તથા પો.કો. મહેન્દ્રભાઈ રમેશભાઈ તથા પો.કો. રાહુલભાઈ વશરામભાઈ તથા પો.કો. મુળુભાઈ વેજાભાઈ તથા પો.કો. નરેશભાઈ ભારમલભાઈ તથા વુ.લોકરક્ષક વંદનાબેન પ્રભુભાઈ નાઓની સંયુક્ત ટીમ વર્ક દ્વારા એલીસબ્રીજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૪/૨૦૧૭ તથા ફ.ગુ.ર.નં. ૯૮/૨૦૧૭ ઈપીકો કલમ ૩૮૦ , ૪૬૧ , ૧૧૪ મુજબના લોકર ચોરીના નાસતા ફરતા આરોપી દ્રોણ ઉર્ફે દેવલ S/o બીપીનભાઈ પંચાલ ઉવ.૩૦ રહે, પ્લોટ નં-૪૨ ફ્લેટ નં-૧૧ નવચંદ્રકુંજ સોસાયટી જવાહરનગર રોડ -૪ ગોરેગાંવ વેસ્ટ મુંબઈ -૬૨ મહારાષ્ટ્ર હાલ રહે, પ્લોટ નં-૨૧૯ ફ્લેટ નં- ૫૦૧ હરણવિલા જવાહરનગર રોડ નં- ૧૪ ગોરેગાંવ વેસ્ટ - ૬૨ મુંબઈ મહારાષ્ટ્ર નાને તા. ૦૬/૦૮/૨૦૧૯ ના રોજ મુંબઈ ગોરેગાંવ ખાતેથી પકડી પાડી અત્રે ગુનાના કામે લાવી ફ.ગુ.ર.નં. ૯૪/૨૦૧૭ ઈપીકો કલમ ૩૮૦ , ૪૬૧ , ૧૧૪ મુજબના ગુનાના કામે તા. ૦૬/૦૮/૧૯ ના ક. ૧૪/૩૦ વાગે અટક કરી યુક્તિ પ્રયુક્તિ થી વિશ્વાસમાં લઈ ગુનાની કબુલાત કરાવી નામદાર કોર્ટમાંથી આરોપીના દિન-૬ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી તેમજ રિમાન્ડ સમય પુર્ણ થતાં ફર્ધર રિમાન્ડ દિન-૭ ના મેળવી મે. ના.પો.કમિ. શ્રી ઝોન-૭ અમદાવાદ શહેર નાઓની મંજૂરી આધારે આરોપી સાથે મુંબઈ ખાતે તપાસમાં જઈ તપાસ દરમ્યાન નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

- (૧) પંચનામા મુજબ અ.નં. ૧ થી ૧૬૧ માં જણાવેલ અલગ અલગ ડિઝાઈનના સોનાના દાગીના કુલે વજન ૩૭૪૯.૪૬ ગ્રામ (૩ કિલો ૭૪૯ ગ્રામ) ના જેની કુલે કિ.રૂ. ૮૫,૫૫,૭૦૦/-
- (૨) રોકડા રૂપીયા ૭,૦૦,૦૦૦/-
- (૩) સોનાની રણી વજન ૪૯૦.૩૨ ગ્રામ કુલ કિ.રૂ. ૧૨,૪૪,૮૦૦/-
- (૪) સોનાની રણી વજન ૭૦૭.૯૪ ગ્રામ કુલ કિ.રૂ. ૧૭,૯૭,૮૧૩/-

જે ઉપરોક્ત સોનાના દાગીના તથા રણીઓ મળી કુલે વજન ૪૯૪૭.૭૨ ગ્રામ જેની કુલે કિ.રૂ. ૧,૧૫,૯૮,૩૧૩/- તથા રોકડા રૂ. ૭,૦૦,૦૦૦/- મળી કુલે કિ.રૂ. ૧,૨૨,૯૮,૩૧૩/- ની મત્તાનો બે ગુનાના કામે કબ્જે કરી તેમજ આરોપીએ પોતાના તેમજ પોતાની પત્નિના HDFC બેંકના ખાતામાં અલગ અલગ એફ.ડી. કુલે રૂ.૫૬ લાખની કરાવેલ જે બંને બેંક ખાતા સીઝ કરાવી પો.સ.ઈ. શ્રી એ.પી. જેબલીયા તથા સર્વેલન્સ સ્કોડની ટીમ દ્વારા પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે. અને ગુના સિવાયના મુદ્દામાલની હાલમાં તપાસ ચાલું છે. તા. ૨૩/૦૮/૨૦૧૯

